



KPI GREEN ENERGY LIMITED

CIN: L40102GJ2008PLC083302



KPI/NP/SEP/2024/558

Date: September 4, 2024

BSE Limited

Phiroze Jeejeebhoy Towers,
Dalal Street,
Mumbai - 400 001

National Stock Exchange of India Limited

Exchange Plaza,
Bandra Kurla Complex,
Bandra (E), Mumbai - 400051

Scrip Code: 542323

Symbol: KPIGREEN

Sub.: Newspaper Advertisement – Notice of 16th Annual General Meeting, Remote E-voting information and Book Closure etc.

Dear Sir/Madam,

Please find attached herewith copies of newspaper advertisements published in the Indian Express (English) and Financial Express (Gujarati), both newspapers having electronic editions, regarding e-voting information and book closure for the 16th Annual General Meeting of the Company in terms of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of Companies (Management and Administration) Rules, 2014 (as amended) and Regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

Kindly take the same on record.

Thanking you,

Yours faithfully,

For KPI Green Energy Limited

Rajvi Upadhyay

Company Secretary & Compliance Officer

Encl.: as above

Reg. Office: 'KP House', Near KP Circle, Opp. Ishwar Farm Junction BRTS, Canal Road, Bhatar, Surat – 395017, Gujarat, India | **NSE BSE Listed Company**

Phone: +91-261-2244757, **Fax:** +91-261-2234757, **E-mail:** info@kpigroup.co, **Website:** www.kpigreenenergy.com

CENTRAL UNIVERSITY OF KASHMIR
Tulmulla, Ganderbal - 191131

(ADMISSION NOTICE -2024) (NON-CUET CANDIDATES)

In view of some vacancies in a few post-graduate programmes, the Non-CUET candidates who are interested in seeking admission and fulfilling the basic eligibility criteria in respective discipline are informed to register online for the admission. The registration process shall start from **03rd September, 2024**. The admission shall be through a Screening Test to be conducted by the respective departments. The final selection shall be based on the merit scored by the candidate in the screening test. For detailed information regarding programmes, registration process & schedule of events, the candidates are advised to visit University website: www.cukashmir.ac.in
Date: 03-09-2024
Directorate of Admissions S/d Director (I/C)

SAL SCHOOL OF ARCHITECTURE
Opp. Science City, Science City Road,
Ahmedabad - 380 060. Phone : 079-67129000

ADMISSION UNDER VACANT QUOTA SEATS FOR 2024-25 FOR M ARCH PROGRAM

Applications invited from eligible Candidates for admission to First Semester Under vacant Quota for M. Arch Programme as per Schedule shown below. Admission will be given on Merit basis only in accordance with the guidelines issued by ACP. Candidates must collect application form for admission from the Students' section and submit along with relevant documents. Acceptance of application form, Declaration of merit list and details of Counselling are as per following schedule. Cost of the application form Rs. 1000/-

Details	Schedule
Form available from institute	27.08.2024 to 10.09.2024
Last date of submission of application with documents	23.09.2024
Inter-se Merit list put on Notice Board	25.09.2024
Date of Counselling for admission	30.09.2024 at 10 am onwards
Note : Incomplete application forms are liable to be cancelled without assigning any specific reason.	Reporting & Registration : 9.30 am NODAL OFFICER

"IMPORTANT"

Whilst care is taken prior to acceptance of advertising copy, it is not possible to verify its contents. The Indian Express (P) Limited cannot be held responsible for such contents, nor for any loss or damage incurred as a result of transactions with companies, associations or individuals advertising in its newspapers or Publications. We therefore recommend that readers make necessary inquiries before sending any monies or entering into any agreements with advertisers or otherwise acting on an advertisement in any manner whatsoever.

KPI GREEN ENERGY LIMITED

CIN: L40102GJ2008PLC083302

Regd. Office: 'KP House', Near KP Circle, Opp. Ishwar Farm Junction BRTS, Canal Road, Bhatar, Surat - 395017, Gujarat, India

Tel & Fax: (0261) 2244757 E-mail: info@kpgroup.co Website: www.kpigreenenergy.com

NOTICE OF THE 16TH ANNUAL GENERAL MEETING AND E-VOTING INFORMATION

NOTICE is hereby given that the 16th Annual General Meeting ('AGM') of the Company will be held on Wednesday, September 25, 2024 at 11:00 a.m. through Video Conference ('VC')/Other Audio Visual Means ('OAVM') to transact the businesses as set out in the Notice of AGM, which is being circulated for convening the AGM. The Company has sent Annual Report for the financial year 2023-24 along with the Notice convening AGM, through electronic mode to the Members whose email addresses are registered with the Company and/ or Depositories in accordance with the Circular issued by the Ministry of Corporate Affairs and Securities and Exchange Board of India. The Annual Report along with the Notice convening the AGM is also available on the website of the Company at www.kpigreenenergy.com and on the website of Central Depository Services (India) Limited (CDSL) at www.evotingindia.com.

Notice is also hereby given that pursuant to the provisions of Section 91 of the Companies Act, 2013 ('Act') and the applicable rules framed thereunder that the Register of Members and Share Transfer Books of the Company will remain closed from Wednesday, September 18, 2024 to Wednesday, September 25, 2024 (both days inclusive) for the purpose of 16th Annual General Meeting of the Company.

Pursuant to the provisions of Section 108 of the Act and Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended and Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Members are provided with the facility to cast their votes on all resolutions as set forth in the Notice convening the AGM using electronic voting system (e-voting) provided by CDSL. The voting rights of Members shall be in proportion to the equity shares held by them in the paid-up equity share capital of the Company as on Tuesday, September 17, 2024 ('cut-off date').

The remote e-voting period commences on Sunday, September 22, 2024 at 09.00 a.m. IST and will end on Tuesday, September 24, 2024 at 5.00 p.m. IST. During this period, the Members may cast their vote electronically. The remote e-voting module shall be disabled by CDSL thereafter. Those Members, who shall be present in the AGM through VC/OAVM facility and had not cast their votes on the Resolutions through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-voting system during the AGM.

The Members who have cast their votes by remote e-voting prior to the AGM may also attend/participate in the AGM through VC/OAVM but shall not be entitled to cast their votes again.

Any person, who acquires shares of the Company and becomes a Member of the Company after the Notice has been sent electronically by the Company, and holds shares as on the cut-off date; may obtain the login ID and password by sending a request to helpdesk.evoting@cdslindia.com. However, if he/she is already registered with CDSL for remote e-voting, then he/she can use his/her existing User ID and password for casting the votes.

In case of any queries pertaining to e-voting, members may refer to the Frequently Asked Questions ('FAQs') and the e-voting manual available at www.evotingindia.com under help section or contact at 022-23058542/43. In case of any grievances relating to e-voting, please contact Mr. Rakesh Dalvi, Sr. Manager, at 25th Floor, A Wing, Marathon Futurex, Mafatlal Mills Compound, NM Joshi Marg, Lower Parel (E), Mumbai - 400013; Email: helpdesk.evoting@cdslindia.com or aforesaid number.

The details of the AGM are available on the website of the Company at www.kpigreenenergy.com, CDSL at www.evotingindia.com, BSE Limited at www.bseindia.com and National Stock Exchange of India Limited at www.nseindia.com.

For KPI Green Energy Limited

Sd/-

Rajvi Upadhyay

Place : Surat

Date : September 4, 2024

Company Secretary & Compliance officer

KP GREEN ENGINEERING LIMITED

(Formerly known as K P Buildcon Private Limited)

CIN: L40100GJ2001PLC039763

Regd. Office: 'KP House', Near KP Circle, Opp. Ishwar Farm Junction BRTS, Canal Road, Bhatar, Surat - 395017, Gujarat, India.

Tel/Fax: (0261) 2244757 E-mail: info@kpgroup.co Website: www.kpgreenengineering.com

NOTICE OF THE 23RD ANNUAL GENERAL MEETING AND E-VOTING INFORMATION

NOTICE is hereby given that the 23rd Annual General Meeting ('AGM') of the Company will be held on Thursday, September 26, 2024 at 11:00 a.m. through Video Conference ('VC')/Other Audio Visual Means ('OAVM') to transact the businesses as set out in the Notice of AGM, which is being circulated for convening the AGM. The Company has sent Annual Report for the financial year 2023-24 along with the Notice convening AGM, through electronic mode to the Members whose email addresses are registered with the Company and/ or Depositories in accordance with the Circular issued by the Ministry of Corporate Affairs and Securities and Exchange Board of India. The Annual Report along with the Notice convening the AGM is also available on the website of the Company at www.kpgreenengineering.com and on the website of Central Depository Services (India) Limited (CDSL) at www.evotingindia.com.

Notice is also hereby given that pursuant to the provisions of Section 91 of the Companies Act, 2013 ('Act') and the applicable rules framed thereunder that the Register of Members and Share Transfer Books of the Company will remain closed from Thursday, September 19, 2024 to Thursday, September 26, 2024 (both days inclusive) for the purpose of 23rd Annual General Meeting of the Company.

Pursuant to the provisions of Section 108 of the Act and Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended and Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Members are provided with the facility to cast their votes on all resolutions as set forth in the Notice convening the AGM using electronic voting system (e-voting) provided by CDSL. The voting rights of Members shall be in proportion to the equity shares held by them in the paid-up equity share capital of the Company as on Wednesday, September 18, 2024 ('cut-off date').

The remote e-voting period commences on Monday, September 23, 2024 at 09.00 a.m. IST and will end on Wednesday, September 25, 2024 at 5.00 p.m. IST. During this period, the Members may cast their vote electronically. The remote e-voting module shall be disabled by CDSL thereafter. Those Members, who shall be present in the AGM through VC/OAVM facility and had not cast their votes on the Resolutions through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-voting system during the AGM.

The Members who have cast their votes by remote e-voting prior to the AGM may also attend/participate in the AGM through VC/OAVM but shall not be entitled to cast their votes again.

Any person, who acquires shares of the Company and becomes a Member of the Company after the Notice has been sent electronically by the Company, and holds shares as on the cut-off date; may obtain the login ID and password by sending a request to helpdesk.evoting@cdslindia.com. However, if he/she is already registered with CDSL for remote e-voting, then he/she can use his/her existing User ID and password for casting the votes.

In case of any queries pertaining to e-voting, members may refer to the Frequently Asked Questions ('FAQs') and the e-voting manual available at www.evotingindia.com under help section or contact at 022-23058542/43. In case of any grievances relating to e-voting, please contact Mr. Rakesh Dalvi, Sr. Manager, at 25th Floor, A Wing, Marathon Futurex, Mafatlal Mills Compound, NM Joshi Marg, Lower Parel (E), Mumbai - 400013; Email: helpdesk.evoting@cdslindia.com or aforesaid number.

The details of the AGM are available on the website of the Company at www.kpgreenengineering.com, CDSL at www.evotingindia.com and BSE Limited at www.bseindia.com.

For KP Green Engineering Limited

(Formerly Known as K P Buildcon Private Limited)

Sd/-

Saurabh Sharma

Place : Surat

Date : September 4, 2024

Company Secretary & Compliance officer

Office of the Additional Chief Engineer, PWD, Zone, Ajmer

No.: ACE/AJ/TECH/F2(30A-Ajmer)/D-2137 Date:-29.08.2024
NIB No:- PWD2425A1309

Notice Inviting Bid No. 10/2024-25

Bids for 02 No. Works are invited from interested bidders upto 12.00 Noon on Friday 20 September 2024. Other particulars of the bid may be visited on the procurement portal (<http://epro.crajasthan.gov.in>, <http://spp.rajinicm.in>) of the State; and DIPR departmental website. The approximate value of the procurement is Rs. 751.51 Lacs.
UBN No.- PWD 2425 WS0B04709
PWD 2425 WS0B04710

(V.K.Jain),
Additional Chief Engineer,
PWD, Zone, Ajmer.

DIPR/C/8017/2024

SHREE BHAVYA FABRICS LIMITED

CIN: L17119GJ1988PLC011120

Registered Office: Survey No. 170, Opp. Advance Petrochem Limited, Pirana Road, Piplej, Ahmedabad 382405 Gujarat

E-Mail : csjd7bhavyafabrics@gmail.com Website: www.shreebhavyafabrics.com

NOTICE OF 36TH ANNUAL GENERAL MEETING, REMOTE E-VOTING INFORMATION AND BOOK CLOSURE

1. Annual General Meeting:
Notice is hereby given to the Members of Shree Bhavya Fabrics Limited that the 36th Annual General Meeting (AGM) of the Company will be held on Monday, September 30, 2024 at 11:00 A.M. IST at 252, New Cloth Market, Opp. Rajpur Gate, Ahmedabad, Gujarat, 380002 to transact the business mentioned in the Notice convening the said Meeting, which is being sent to the Members.

2. Book Closure for AGM:
Register of Members and the Share Transfer Books of the Company will remain closed from Tuesday, 24th September, 2024 to Monday, 30th September, 2024 (both days inclusive) for the said Annual General Meeting.

3. Voting through Electronic Mode:
Pursuant to Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 44 of the SEBI (LODR) Regulation 2015 that the Company is providing its members the facility to exercise their right to vote by electronic means ("remote e-voting"), as provided by National Services Depository Limited ("NSDL"), on all resolutions as set out in the Notice of the 36th AGM.

a) Date and time of commencement of remote e-voting: Friday, September 27th, 2024 at 9.00 a.m.
b) Date and time of end of remote e-voting: Sunday, September 29th, 2024 at 5.00 p.m.
c) Cut-off date for determining the eligibility to vote: Monday 23rd September, 2024.

d) Those Members, who shall be present in the AGM and had not cast their votes on Resolutions through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote at AGM through ballot paper. The Members who have cast their votes by remote e-voting prior to the AGM may also attend/participate in the AGM but shall not be entitled to cast their votes again.

a) Notice of 36th AGM is available on the Company's website www.shreebhavyafabrics.com and on the website of Stock Exchange www.bseindia.com.

b) In case you have any queries or issues regarding e-voting, you may refer the Frequently Asked Questions ("FAQs") and e-voting manual available at www.evotingindia.com under help section or write an email to helpdesk.evoting@nsdl.co.in

For, Shree Bhavya Fabrics Limited
Chetan Jain
Company Secretary & Compliance Officer

Date: 03.09.2024

Place: Ahmedabad

**Tirupati**
Forge Limited

CIN: L27320GJ2012PLC071594

Registered Office: Plot No. 1-5, Survey No. 92/1, Near Shan Cement, Hadamtala Industrial Area, Taluka: Kotda Sangani, Hadamtala, Rajkot-360311 Gujarat, India. Contact: 02827-270512
E-mail : cs@tirupatiforge.com Website: www.tirupatiforge.com

NOTICE OF 12TH ANNUAL GENERAL MEETING, REMOTE E-VOTING & BOOK CLOSURE INFORMATION

Notice is hereby given that the Twelfth (12th) Annual General Meeting (hereinafter called AGM) of the Company will be held on Friday, September 27, 2024 at 12:30 P.M. at registered office of the company at Plot No. 1-5, Survey No. 92/1, Near Shan Cement, Hadamtala Industrial Area, Tal: Kotda Sangani Hadamtala Rajkot: 360311 (Gujarat) India to transact the business as set out in the Notice of 12th AGM.

1. Electronic Copies of the Notice of 12th AGM and Annual Report of the Company for the Financial Year 2023-24 have been sent to all the members whose email IDs are registered with the Company/Depository Participant. Annual Report along with the Notice is also available at the website of the Company www.tirupatiforge.com. National Stock Exchange of India Limited www.nseindia.com and National Securities Depository Limited at www.evoting.nsdl.com.

2. A Member entitled to attend and vote, is entitled to appoint a proxy to attend and vote instead of himself and the proxy need not be a Member of the Company. A person can act as proxy on behalf of Members not exceeding Fifty (50) and holding in the aggregate not more than ten percent (10%) of the total share capital of the Company. In case a proxy is proposed to be appointed by a Member holding more than 10% of the total share capital of the Company carrying voting rights, then such proxy shall not act as a proxy for any other Member. The instrument of Proxy, in order to be effective, should be deposited at the Registered Office of the Company, duly completed, signed and stamped, not less than 48 hours before the commencement of the Meeting. Proxies submitted on behalf of Limited Companies, Societies, etc., must be supported by appropriate resolutions/authority, as applicable.

3. In compliance with provision of section 108 of the Companies Act, 2013 read with rule made thereunder, as amended from time to time and, Regulation 44 of the SEBI (Listing obligations and disclosure requirements) Regulations, 2015, the Company is providing the remote e-voting facility to members to cast their vote by electronically through electronic voting system of NSDL through their Insta Vote platform from a place other than venue of AGM ("remote e-voting"). All members are informed that:

a. The business stated in the notice of 12th AGM may be transacted through voting by electronic means;
b. The remote e-voting shall commence on Tuesday, September 24, 2024 at 9.00 a.m. and ends on Thursday, September 26, 2024 at 5.00 p.m. The remote e-voting module shall be disabled by NSDL thereafter;
c. The cut-off date for determining the eligibility to vote by electronic means or at the AGM is Friday, September 20, 2024.

d. The persons who acquire the shares and becomes the member of the Company after dispatch of notice AGM and holding shares as on cut-off date i.e. Friday, September 20, 2024 may cast their votes by following instructions and process of remote e-voting as provided in the Notice of AGM.

e. In case of any Queries relating to remote e-voting, member/ beneficial owner may contact National Securities Depository Limited through sending e-mail to evoting@nsdl.com or call us:- + 022 - 4886 7000.

f. Shareholders who have not registered their e-mail address and in consequence the Annual Report, Notice of AGM and e-voting notice could not be serviced, may also temporarily provide their email address and mobile number to the Company's Registrar and Share Transfer Agent at rt.helpdesk@linkintime.co.in or write us at cs@tirupatiforge.com

g. The members may note that;

a.i. Once the e-vote on the resolution is cast by the members, they shall not be allowed to change it subsequently;
a.ii. The facility for voting through ballot paper shall be made available at the AGM for the members who have not cast their vote by remote e-voting;
a.iii. The members who have cast their vote by remote e-voting may also attend the AGM but shall not be entitled to cast their vote again and;
a.iv. The person whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date only shall be entitled to avail the facility of remote e-voting as well as voting at AGM.

4. Pursuant to Regulation 42 of the SEBI (Listing obligations and disclosure requirements) Regulations, 2015, and section 91 of the Companies Act, 2013 and applicable rule thereunder, the register of members and share transfer book for Equity Shares of the Company will remain closed from Saturday, September 21, 2024 to Friday, September 27, 2024 (both days inclusive), for the purpose of Annual General Meeting for the financial year ended on March 31, 2024.

5. The Company has appointed CS Piyush Jethwa as the Scrutinizer for overseeing/conducting the voting process in a fair and transparent manner.
6. The result of the e-voting/ voting at AGM shall be declared within two working days of conclusion of the AGM. The Results declared, along with the Scrutinizer's Report, shall be displayed at the Registered Office of the Company and also be placed on the Company's website, website of NSDL and communicated to the Stock Exchange where the Company's shares are listed.

By Order of the Board
For, TIRUPATI FORGE LIMITED

Sd/-

HITESHKUMAR G. THUMMAR

Managing Director

DIN: 02112952

Date : 04/09/2024

Place : Hadamtala (Rajkot)

ONLINE TENDERING**STATUE OF UNITY AREA DEVELOPMENT AND TOURISM GOVERNANCE AUTHORITY****TENDER NOTICE NO. 10YEAR 2024-25**

Tender for below mentioned works are invited by Executive Engineer, Division 2, SOU ADTGA, Ekta Nagar from eligible government registered contractor

<https://ssml.nprocure.com>, <http://nprocure.com>, www.statetenders.com for more information

Sr.	Name of Work	Tender Amount (in lacs)	Tender Fees	Earnest Not less than 6 Month	Category
1	Providing and Fixing Chain Link Fencing with Barbed wire near Khalvani, Vagadia, Ekta Nursery and Gora Village	98.41	Rs. 2832.00	Rs. 98,500.00	Class "D" & Above

Online Submission Last Date Up to 09/09/2024 up to 18.00 hours.

Tender Fees / Earnest Money and other document submission date (Physical Submission Last Date) (R.P.A.D Speed post, courier) Up to date 14/09/2024 up to 18.00 hours.

Tender opening Date (Price Bid) On date 15/09/2024 @ 16.00 hours onward (If possible)

For more information visit above website <http://nprocure.com>

INF/NARMADA/228/2024-25

VADILAL CHEMICALS LIMITED

Regd. Office : 201, 2nd Floor, Puniska House, Next to One 42, Opp. Jayantilal Park BRTS Bus Stand, Ambli Bopal Road Ahmedabad-380058. Ph.: 079-48081200, Web: <https://vadilalchemicals.in>,

CIN : L24231GJ1991PLC015390,

Email : info.vcl@vadilalgroup.com

NOTICE OF THE 33RD ANNUAL GENERAL MEETING, BOOK-CLOSURE AND REMOTE E-VOTING INFORMATION.

NOTICE is hereby given that the 33rd Annual General Meeting ("AGM") of the members of Vadilal Chemicals Limited will be held on Thursday, 26th September, 2024 at 02.00 p.m., through Video Conferencing ("VC")/ Other Audio Visual Means ("OAVM") to transact the business as set out in the Notice of AGM dated 6th August, 2024.

The Ministry of Corporate Affairs (MCA) has vide its circular No. 14/2020, 17/2020, 20/2020, 2/2021, 3/2022 and 10/2022 and 09/2023 dated April 8, 2020, April 13, 2020, May 5, 2020, January 13, 2021, May 5, 2022, December 28, 2022 September 25, 2023 respectively (collectively referred as 'MCA Circulars') and Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79, SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11, SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62 and SEBI/HO/CFD/PoD-2/P/CIR/2023/4, SEBI/HO/CFD/CFD-PoD-2/P/CIR/2023/167 dated May 12, 2020, January 15, 2021, May 13, 2022, January 5, 2023 and October 7, 2023 respectively issued by the Securities and Exchange Board of India (SEBI Circulars) permitted holding of AGM through VC or OAVM, without the physical presence of Members at a common venue. In compliance with these MCA Circulars and the relevant provisions of Companies Act, 2013 along with SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Annual General Meeting of the members of the Company will be held through VC/ OAVM. Members can attend and participate in the AGM through VC/ OAVM facility. The instructions for joining the AGM has been provided in the Notice of the AGM. Members attending the Meeting through VC/ OAVM shall be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Companies Act, 2013.

In compliance with the Act, the Rules made there under and the above Circulars, the Notice of 33rd Annual General Meeting along with Annual Report for the financial year 2023-24 has been sent by E-mail to those Members whose Email addresses are registered with the Company or Registrar & Share Transfer Agent or Depository Participant(s). The Notice of AGM and the Annual Report for the Financial Year 2023-24 is available on the Company's website at <https://vadilalchemicals.in> and on the website of Central Depository Services Limited (CDSL) at www.evotingindia.com

As per Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 44(1) of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company is pleased to provide to its Members the facility to cast their votes by electronic means (remote e-voting) on all the resolutions set forth in the Notice through Central Depository Services (India) Limited (CDSL). The remote e-voting period commences on Monday, 23rd September, 2024 (9:00 am) and ends on Wednesday, 25th September, 2024 (5:00 pm). During this period and at the time of Annual General Meeting, shareholders of the Company may cast their vote electronically. The e-voting module shall be disabled by CDSL for voting thereafter.

The voting rights of members shall be in proportion to their shares of the paid up equity share capital of the Company as on the cut-off date of Thursday, 19th September, 2024. Any person, who acquires shares of the Company and become member of the Company after dispatch of the notice and holding shares as of the cut-off date i.e. 19th September, 2024 may obtain the login ID and password by sending a request to helpdesk.evoting@cdslindia.com. Members who have not registered their Email address are requested to register their Email address with Company or Registrar or Share Transfer Agent or Depository Participant.

Members attending the AGM who have not cast their votes by Remote E-voting shall be eligible to cast their votes through E-voting during AGM. Members who have voted through Remote E-voting shall be eligible to attend the AGM. However, they shall not be eligible to vote at the meeting. The procedure of electronic voting (e-voting) is available in the Notice of the AGM.

NOTICE is also hereby given pursuant to Section 91 of the Companies Act, 2013, Rules 10 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation, 42 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 that the Register of Members and Share Transfer Books of the Company will remain closed from 20th September, 2024 to 26th September, 2024 (both days inclusive) for the purpose of Annual General Meeting for the year ended on 31st March, 2024 and for the purpose of determining the members who would be entitled to dividend, if declared at the Annual General Meeting. The Dividend on Equity Shares, if declared at the aforesaid Meeting will be credited/ dispatched on or after 26th September, 2024 to those Members whose names appear on the Company's Register of Members/ List of beneficial owners to be furnished by the depositories at the end of the business hours on Cut off date i.e. 19th September, 2024.

Manner of Registering/ uploading email addresses to receive the Notice of AGM along with the Annual Report:

As per MCA Circulars and SEBI Circulars, no physical copies of the Notice

કેપી ગ્રીન એન્જીનીયરીંગ લિમિટેડ

(કે.પી. ગ્રીન એન્જીનીયરીંગ લિમિટેડ તરીકે જાણીતા)

CIN: L40100GJ2001PLC039763

રજીસ્ટર્ડ ઓફીસ: 'કેપી હાઉસ', કેપી સર્કલની પાસે, ઈશ્વર કાર્મ જંકશન બી.આર.ટી.એસ.ની સામે, કેનાલ રોડ, ભટાર, સુરત-૩૬૫૦૧૭, ગુજરાત, ભારત.

ટેલિફોન/ફેક્સ: (૦૨૬૧)૨૨૪૪૭૫૭ ઈ-મેઇલ: info@kpgroup.co વેબસાઇટ: www.kpgreenengineering.com

૨૩મી વાર્ષિક સામન્ય સભાની નોટીસ તથા ઈ-વોટિંગ માટેની માહિતી

આથી નોટીસ આપવામાં આવે છે કે, કેપી ગ્રીન એન્જીનીયરીંગ લિમિટેડના શેરદારાકોની ૨૩મી વાર્ષિક સામાન્ય સભા (એજુએમ) ગુરુવાર, ૨૨મી સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે વીડીઓ કોન્ફરન્સ ('વીસી')/અન્ય ઓડીઓ વીડીઓ માધ્યમ ('ઓએવીએમ') દ્વારા યોજાશે, જેમાં એજુએમની નોટીસમાં દર્શાવવામાં આવ્યા મુજબના કાર્યો હાથ ધરાશે. મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટસ અફેર્સ ('એમસીએ') અને સિક્કોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા ('સેબી')ના પરિપત્રોને ધ્યાનમાં રાખતા એજુએમની નોટીસ અને નાણાકિય વર્ષ ૨૦૨૩-૨૪ માટેની વાર્ષિક અહેવાલ ઈલેક્ટ્રોનિક મોડેલ જે સભાના ઈ-મેઇલ આઈડી કંપની/ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ સમક્ષ નોંધાયેલા તેમને મોકલી આપવામાં આવ્યા છે. એજુએમની નોટીસ તથા વાર્ષિક અહેવાલ કંપનીની વેબસાઇટ www.kpgreenengineering.com તથા સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ(ઈન્ડિયા) લિમિટેડ ('સીડીએસએલ')ની વેબસાઇટ www.evotingindia.com પર પણ ઉપલબ્ધ છે.

કંપનીની ધારા, ૨૦૧૩ની કલમ ૯૧ હેઠળની જોગવાઈઓ તેમજ તે મુજબ ઘડાયેલા નિયમો અન્યથે આથી એ બાબતે પણ નોટીસ આવે છે કે કંપનીના સભ્યોનું રજીસ્ટર તથા શેર ટ્રાન્સફર બુક્સ ગુરુવાર, ૧૯મી સપ્ટેમ્બર, ૨૦૨૪થી ગુરુવાર, ૨૨મી સપ્ટેમ્બર, ૨૦૨૪(બંને દિવસો સહિત) ૨૩મી એજુએમના હેતુઓ બંધ રહેશે. કંપનીની ધારા, ૨૦૧૩ની કલમ ૧૦૮ની જોગવાઈઓ તથા સુધારા સહિતના કંપનીના(મેનેજમેન્ટ એન્ડ એક્સિનિસ્ટ્રેશન) રૂલ્સ, ૨૦૧૪ના નિયમ ૨૦ તેમજ સિક્કોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સિક્કોરિટીઝ ઓરિલિગેશન એન્ડ ડિસ્ક્લોઝર રેગ્યુલેશન) ૨૦૧૫ના નિયમન યજ અન્યથે, એજુએમની નોટીસમાં વર્ણવવામાં આવેલા તમામ ઠરાવો ઉપર સભ્યોને તેમનો મત ઈલેક્ટ્રોનિકલી આપવા માટે ઈ-વોટિંગ ની સુવિધા સીડીએસએલ મારફતે પુરી પાડવામાં આવેલ છે. મતના અધિકારો સભ્યો પાસે બુધવાર, ૧૯મી સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજની સ્થિતિ મુજબ રહેલા શેર્સની સંખ્યાના આધારે પ્રમાણસર ગણાશે, કે જે કટ ઓફ તારિખ છે.

રિમોટ ઈ-વોટિંગના સમયગાળાની શરૂઆત સોમવાર, ૨૩મી સપ્ટેમ્બર ૨૦૨૪ સવારે ૦૯:૦૦ વાગે અને બુધવાર, ૨૨મી સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ સાંજે ૫:૦૦ વાગે પુરી થશે. આ સમયગાળા દરમિયાન, સભ્યો ઈલેક્ટ્રોનિકલી મત આપી શકશે. એ પછી રિમોટ ઈ-વોટિંગ મોડ્યુલ ડિસ્બેલ કરી દેવાશે. રિમોટ ઈ-વોટિંગનો વિકલ્પ નહિ ઉપયોગ કર્યો હોય અને જે સભ્યો એજુએમમાં વીસી/ઓએવીએમ દ્વારા હાજર રહ્યા હશે તે સભ્યો એજુએમમાં ઈલેક્ટ્રોનિક સિસ્ટમ દ્વારા મત આપી શકશે.

એકવાર સભ્યે કોઈ એક ઠરાવ ઉપર રિમોટ ઈ-વોટિંગ દ્વારા મત આપી દિધો હોય તો તેઓ વીસી/ઓએવીએમ દ્વારા એજુએમમાં ભાગ લઈ શકશે, પણ તેમને એજુએમમાં ફરીથી મતદાન કરવાની મંજૂરી મળશે નહીં.

સભાની નોટિસ મોકલી આપ્યા પછી કોઈ વ્યક્તિ કંપનીની સભ્ય બની હોય અને તેઓ કટ-ઓફ તારીખના દિવસે શેર્સ ધરાવતી હોય તો તેઓએ helpdesk.evoting@cdslindia.comને ઈ-મેઇલથી વિનંતી કરી ચુગર આઈડી તથા પાસવર્ડ પ્રાપ્ત કરવાના રહેશે. જોકે એ વ્યક્તિ સીડીએસએલ સમક્ષ ઈ-વોટિંગ માટે અગાઉથી જ નોંધાયેલી હોય તો, તમો પોતાના એજ ચુગર આઈડી તથા પાસવર્ડના ઉપયોગથી પોતાનો મત આપી શકે છે.

ઈ-વોટિંગ સંબંધિત કોઈ પત્રો હોય, તો સભ્યો તે માટે www.evotingindia.com ઉપર હેલ્પ ડેસ્ક સેક્શનમાં (ફ્રીકવનલી આસ્કડ ક્વેશ્ચન્સ) 'FAQs' (અવાર નવાર પુછાતા પત્રો)નો અને ઈ-વોટિંગ મેન્યુઅલનો ઉપયોગ કરી શકે છે અથવા helpdesk.evoting@cdslindia.com પર ઈ-મેઇલ કરી શકે છે અથવા નંબર: ૦૨૨-૨૩૦૫૮૫૨૪/૪૩ પર ફોન કરીને જાણકારી મેળવી શકે છે. ઈ-વોટિંગને લગતી કોઈપણ ફરીયાદ હોય તો, શ્રી રાકેશ દલવી, સીનીયર મેનેજર, સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઈન્ડિયા) લિમિટેડ, એ વિંગ, ૨મો માળ, મેરેથોન ડ્રયુયરેકસ, મફતલાલ મિલ કમ્પાઉન્ડ્સ, એન. એમ. જોશી માર્ગ, લોઅર પરેલ(પુર્વ), મુંબઈ - ૪૦૦૦૧૩ નો સંપર્ક ઈ-મેઇલ: helpdesk.evoting@cdslindia.com અથવા ઉપરોક્ત નંબર ઉપર કરી શકાશે.

એજુએમને લગતી માહિતી કંપનીની વેબસાઇટ www.kpgreenengineering.com સીડીએસએલની વેબસાઇટ: www.evotingindia.com તથા સ્ટોક એક્સચેન્જની વેબસાઇટ www.bseindia.com પર પણ ઉપલબ્ધ છે.

કેપી ગ્રીન એન્જીનીયરીંગ લિમિટેડ

(કે.પી. ગ્રીન એન્જીનીયરીંગ લિમિટેડ તરીકે જાણીતા)

સ્થળ: સુરત સૌભ શર્મા તારીખ: ૪ સપ્ટેમ્બર, ૨૦૨૪ કંપની સેક્રેટરી અને કમ્પ્લાઈન્સ ઓફીસર

કેપીઆઈ ગ્રીન એનર્જી લિમિટેડ

CIN: L40102GJ2008PLC083302

રજીસ્ટર્ડ ઓફીસ: 'કેપી હાઉસ', કેપી સર્કલની પાસે, ઈશ્વર કાર્મ જંકશન બી.આર.ટી.એસ.ની સામે, કેનાલ રોડ, ભટાર, સુરત-૩૬૫૦૧૭, ગુજરાત, ભારત.

ટેલિફોન/ફેક્સ: (૦૨૬૧)૨૨૪૪૭૫૭ ઈ-મેઇલ: info@kpgroup.co વેબસાઇટ: www.kpigreenenergy.com

૧૬મી વાર્ષિક સામન્ય સભાની નોટીસ તથા ઈ-વોટિંગ માટેની માહિતી

આથી નોટીસ આપવામાં આવે છે કે, કેપીઆઈ ગ્રીન એનર્જી લિમિટેડના શેરદારાકોની ૧૬મી વાર્ષિક સામાન્ય સભા (એજુએમ) બુધવાર, ૨૨મી સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે વીડીઓ કોન્ફરન્સ ('વીસી')/અન્ય ઓડીઓ વીડીઓ માધ્યમ ('ઓએવીએમ') દ્વારા યોજાશે, જેમાં એજુએમની નોટીસમાં દર્શાવવામાં આવ્યા મુજબના કાર્યો હાથ ધરાશે. મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટસ અફેર્સ ('એમસીએ') અને સિક્કોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા ('સેબી')ના પરિપત્રોને ધ્યાનમાં રાખતા એજુએમની નોટીસ અને નાણાકિય વર્ષ ૨૦૨૩-૨૪ માટેની વાર્ષિક અહેવાલ ઈલેક્ટ્રોનિક મોડેલ જે સભાના ઈ-મેઇલ આઈડી કંપની/ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ સમક્ષ નોંધાયેલા તેમને મોકલી આપવામાં આવ્યા છે. એજુએમની નોટીસ તથા વાર્ષિક અહેવાલ કંપનીની વેબસાઇટ www.kpigreenenergy.com તથા સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ(ઈન્ડિયા) લિમિટેડ ('સીડીએસએલ')ની વેબસાઇટ www.evotingindia.com પર પણ ઉપલબ્ધ છે.

કંપનીની ધારા, ૨૦૧૩ની કલમ ૯૧ હેઠળની જોગવાઈઓ તેમજ તે મુજબ ઘડાયેલા નિયમો અન્યથે આથી એ બાબતે પણ નોટીસ આવે છે કે કંપનીના સભ્યોનું રજીસ્ટર તથા શેર ટ્રાન્સફર બુક્સ બુધવાર, ૧૯મી સપ્ટેમ્બર, ૨૦૨૪થી બુધવાર, ૨૨મી સપ્ટેમ્બર, ૨૦૨૪(બંને દિવસો સહિત) ૧૬મી એજુએમના હેતુઓ બંધ રહેશે. કંપનીની ધારા, ૨૦૧૩ની કલમ ૧૦૮ની જોગવાઈઓ તથા સુધારા સહિતના કંપનીના(મેનેજમેન્ટ એન્ડ એક્સિનિસ્ટ્રેશન) રૂલ્સ, ૨૦૧૪ના નિયમ ૨૦ તેમજ સિક્કોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સિક્કોરિટીઝ ઓરિલિગેશન એન્ડ ડિસ્ક્લોઝર રેગ્યુલેશન) ૨૦૧૫ના નિયમન યજ અન્યથે, એજુએમની નોટીસમાં વર્ણવવામાં આવેલા તમામ ઠરાવો ઉપર સભ્યોને તેમનો મત ઈલેક્ટ્રોનિકલી આપવા માટે ઈ-વોટિંગ ની સુવિધા સીડીએસએલ મારફતે પુરી પાડવામાં આવેલ છે. મતના અધિકારો સભ્યો પાસે મંગળવાર, ૧૯મી સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજની સ્થિતિ મુજબ રહેલા શેર્સની સંખ્યાના આધારે પ્રમાણસર ગણાશે, કે જે કટ ઓફ તારિખ છે.

રિમોટ ઈ-વોટિંગના સમયગાળાની શરૂઆત રવિવાર, ૨૨મી સપ્ટેમ્બર ૨૦૨૪ સવારે ૦૯:૦૦ વાગે અને મંગળવાર, ૨૨મી સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ સાંજે ૫:૦૦ વાગે પુરી થશે. આ સમયગાળા દરમિયાન, સભ્યો ઈલેક્ટ્રોનિકલી મત આપી શકશે. એ પછી રિમોટ ઈ-વોટિંગ મોડ્યુલ ડિસ્બેલ કરી દેવાશે. રિમોટ ઈ-વોટિંગનો વિકલ્પ નહિ ઉપયોગ કર્યો હોય અને જે સભ્યો એજુએમમાં વીસી/ઓએવીએમ દ્વારા હાજર રહ્યા હશે તે સભ્યો એજુએમમાં ઈલેક્ટ્રોનિક સિસ્ટમ દ્વારા મત આપી શકશે. એકવાર સભ્યે કોઈ એક ઠરાવ ઉપર રિમોટ ઈ-વોટિંગ દ્વારા મત આપી દિધો હોય તો તેઓ વીસી/ઓએવીએમ દ્વારા એજુએમમાં ભાગ લઈ શકશે, પણ તેમને એજુએમમાં ફરીથી મતદાન કરવાની મંજૂરી મળશે નહીં.

સભાની નોટિસ મોકલી આપ્યા પછી કોઈ વ્યક્તિ કંપનીની સભ્ય બની હોય અને તેઓ કટ-ઓફ તારીખના દિવસે શેર્સ ધરાવતી હોય તો તેઓએ helpdesk.evoting@cdslindia.comને ઈ-મેઇલથી વિનંતી કરી ચુગર આઈડી તથા પાસવર્ડ પ્રાપ્ત કરવાના રહેશે. જોકે એ વ્યક્તિ સીડીએસએલ સમક્ષ ઈ-વોટિંગ માટે અગાઉથી જ નોંધાયેલી હોય તો, તમો પોતાના એજ ચુગર આઈડી તથા પાસવર્ડના ઉપયોગથી પોતાનો મત આપી શકે છે.

ઈ-વોટિંગ સંબંધિત કોઈ પત્રો હોય, તો સભ્યો તે માટે www.evotingindia.com ઉપર હેલ્પ ડેસ્ક સેક્શનમાં (ફ્રીકવનલી આસ્કડ ક્વેશ્ચન્સ) 'FAQs' (અવાર નવાર પુછાતા પત્રો)નો અને ઈ-વોટિંગ મેન્યુઅલનો ઉપયોગ કરી શકે છે અથવા helpdesk.evoting@cdslindia.com પર ઈ-મેઇલ કરી શકે છે અથવા નંબર: ૦૨૨-૨૩૦૫૮૫૨૪/૪૩ પર ફોન કરીને જાણકારી મેળવી શકે છે. ઈ-વોટિંગને લગતી કોઈપણ ફરીયાદ હોય તો, શ્રી રાકેશ દલવી, સીનીયર મેનેજર, સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઈન્ડિયા) લિમિટેડ, એ વિંગ, ૨મો માળ, મેરેથોન ડ્રયુયરેકસ, મફતલાલ મિલ કમ્પાઉન્ડ્સ, એન. એમ. જોશી માર્ગ, લોઅર પરેલ(પુર્વ), મુંબઈ - ૪૦૦૦૧૩ નો સંપર્ક ઈ-મેઇલ: helpdesk.evoting@cdslindia.com અથવા ઉપરોક્ત નંબર ઉપર કરી શકાશે.

એજુએમને લગતી માહિતી કંપનીની વેબસાઇટ www.kpigreenenergy.com સીડીએસએલની વેબસાઇટ: www.evotingindia.com, સ્ટોક એક્સચેન્જની વેબસાઇટ www.bseindia.com તથા નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયાની વેબસાઇટ www.nseindia.com પર પણ ઉપલબ્ધ છે.

કેપીઆઈ ગ્રીન એનર્જી લિમિટેડ

(કે.પી. ગ્રીન એનર્જી લિમિટેડ તરીકે જાણીતા)

સ્થળ: સુરત રાજવી ઉપાધ્યાય તારીખ: ૪ સપ્ટેમ્બર, ૨૦૨૪ કંપની સેક્રેટરી અને કમ્પ્લાઈન્સ ઓફીસર

PUBLIC NOTICE

We, KAMAL SURENDRABAI INAMDAR (Deceased) and HEMLATA KAMAL INAMDAR (PAN AMXP10536N) alias HITAKAMAL INAMDAR, jointly holding 4 shares of Face Value Rs. 100/- in Bosch Limited (formerly: Motor Industries Company Limited) having its registered office at Hosur Road, Adugodi, Bangalore - 560030 in Folio I00173 bearing Share Certificate Numbers 00014787 and 00057111 with Distinctive Numbers from 1266999- 1266999 and 1697385- 1697387.

I hereby give notice that the said Share Certificate(s) are lost and I have applied to the Company for issue of duplicate Share Certificates and exchange of the same with Face Value Rs.10/-certificate.

The public is hereby warned against purchasing or dealing in anyway with the said Share Certificates. The Company may issue duplicate Share Certificates if no objection is received by the Company within 30 days of the publication of this advertisement, after which no claim will be entertained by the Company in that behalf.

Place: Surat Hemlata Kamal Inamdar Date : 04-09-2024 Folio No : 100173

સિદ્ધાર્થ યોગે ટ્રેન્ટના ૧૦ લાખ શેરો ૭૧૮ કરોડમાં ખરીદ કર્યા

પીટીઆઈ નવી દિલ્હી, તા. ૩ વૈશ્વિક રાકાણાકાર સિદ્ધાર્થ યોગે મુકત બજારમાં સોદો કરીને તાતા ગ્રુપની ટિટેલ કંપની ટ્રેન્ટ લિમિટેડના ૩૧.૭૧૮ કરોડના મૂલ્યના ૧૦ લાખ શેરોની ખરીદી કરી છે. યોગ ઝેન્ડર ગ્રુપ ઇન્કના સ્થાપક ભાગીદાર છે. જેનું કુલ સોદા મૂલ્ય રૂપિયા ૭૧૮.૦૪ કરોડ જેટલું થાય છે. આ ડેટા દર્શાવે છે કે ડોડોના હોલિંગ્સે ઇકવિટી શેરટીક રૂ ૧.૭, ૧૧૫માં સમાન સંખ્યામાં સંચાલન કરે છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) પર ઉપલબ્ધ બ્લોક ડીલના ડેટા અનુસાર, સિદ્ધાર્થ યોગે ટ્રેન્ટ લિમિટેડમાંનો ૦.૩ ટકા હિસ્સો કે ૧૦,૦૮,૨૦૦ ઇકવિટી શેર ખરીદ્યા છે. આ ઇકવિટી શેરોની ખરીદી શેરટીક રૂ.૭, ૧૧૫ના સરેરાશ ભાવમાં કરવામાં આવી છે, જેનું કુલ સોદા મૂલ્ય રૂપિયા ૭૧૮.૦૪ કરોડ જેટલું થાય છે. આ ડેટા દર્શાવે છે કે ડોડોના હોલિંગ્સે ઇકવિટી શેરટીક રૂ ૧.૭, ૧૧૫માં સમાન સંખ્યામાં શેરોની વેચાણ કર્યું છે. ટ્રેન્ટના શેરના ભાવ ગઇકાલે એનએસઈ પર ૦.૦૮ ટકા ઘટીને રૂ.૭, ૧૧૫.૮૫ના સ્તરે બંધ થયો હતો. ગયા મહિને સિદ્ધાર્થ યોગે રૂ ૧.૬૪૮ કરોડના સંયુક્ત મૂલ્ય માટે અલગ બ્લોક ડીલ દ્વારા ડોડોના હોલિંગ્સ લિમિટેડ પાસેથી ફેશન અને લાઇફસ્ટાઇલ કંપની ટ્રેન્ટનો ૦.૨૭ ટકા હિસ્સો અથવા ૮.૪૮ લાખ ઇકવિટી શેર ખરીદ કર્યા હતા.

Table with 4 columns: ક્રમ નં., કચ્છદાર/ જમીનદારો/ સહ-કચ્છદારનું નામ, ડિમાન્ડ નોટીસ તારીખ અને બાકી રકમ (વ્યાજબ્યાજીત્સ-રીકવરી), અચલિત મિલકતોની વિગતો, કલબજાની તારીખ અને પ્રકાર. The table lists various shareholders and their details regarding share transfers and payments.

કૃપા કરીને એ બાબતની વધુ નોંધ લેશો કે ઉપરોક્ત કાચ્છદારની કલમ 13ની પેટાકલમ 13માં ઉલ્લેખ કર્યા મુજબ, તમે અમરાઈ બેંકની આગોતરી લેખિત સંમતિ વિના આ નોટિસમાં ઉલ્લેખિત જામીનગીરી હેલ્ડ જણાવેલી કોઈ પણ અસ્કયામતોના વેચાણ, બાડાપટ્ટા અથવા અન્ય કોઈ પણ રીતે તબદિલી કરી શકશો નહીં. તારીખ : 04.09.2024, સ્થળ : ગુજરાત નોંધ : (બિવાહ ની સ્થિતિમાં અંગેજી અવિનિત માન્ય સમવામાં અચલો) અધિકૃત અધિકારી, એક્સિસ બેંક લિ.